

કામગીરી

રાજકોટ ગ્રામ્ય રાજકોટ

1. જેતપુર નવાગઢ વિસ્તારમાંથી જુગાર નો કવોલિટી કેશ પકડી પાડતી જેતપુર સિટી પોલીસ...

શ્રી પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ ડીવાયએસપી શ્રી જે એમ ભરવાડ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પી.આઈ વી.આર. વાણીયા તથા હેડ કોન્સ સંજયભાઈ પરમાર તથા પો.કોન્સ ભાવેશભાઈ ચાવડા તથા ચેતનભાઈ ઠાકોર તથા રામજી ભાઈ ગરેજા તથા મહિલા પો.કોન્સ દિવ્યાબેન એમ બધા જેતપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભાવેશભાઈ ચાવડાને મળેલ બાતમી આધારે જેતપુર નવાગઢ ઈટોના ભક્ષ પાસે જાહેરમાં જુગાર રમતા (૧)સલીમ સિકંદર આદમભાઈ લાખાણી (૨)દિનેશભાઈ અર્જુનભાઈ સોલંકી (૩) નજમા ફિરોજ ભાઈ સમા (૪)જશીબેન ગીગાભાઈ છાપરા રહે બધા જેતપુર વાળાને ગંજી પત્તા ના પાના તથા રૂપિયા ૨૦૧૯૦/ ના મુદ્દામાલ સાથે પકડી જુ.ધા કલમ ૧૨ મુજબ નો ગુન્હે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

2. ગરીયાધાર પો.સ્ટે ના ગુન્હાના કામના આરોપીને ઝડપી પાડતી આટકોટ પોલીસ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચનાથી ગોંડલ Dysp ડી.એમ.ચૌહાણ સાહેબ તથા આટકોટ પો.સ્ટે ના પી.એસ.આઈ બી.એફ.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ નિરાવભાઈ.આર.વાણીયા તથા Q.R.T ટીમના પો.હેડ.કોન્સ ગોપાલભાઈ એમ.ઘાઘલ તથા pc.નરેશભાઈ.એ.રાહોડ તથા pc.હિતેશભાઈ.આર.ડેરવાળીયા તથાpc.સુરેશભાઈ.એસ.જાપડીયા અમે બધા પો.સ્ટે.હાજર હતા તે દરમિયાન ગારિયાધાર પો.સ્ટે ના પ્રોહિ ગુ.ર.ન- 205/18 પ્રોહિ કલમ- 66.a.e,116-b ના કામનો આરોપી હુસેન હરુનભાઈ રહે- આટકોટ વાળા ની વોચમાં રેહવા બાબત નો ઈ-મેઈલ આવતા પો.હેડ.કોન્સ ગોપાલભાઈ ઘાઘલની ખાનગી બાતમીના આધારે વોચમાં રેહતા આટકોટ હુસેન ચોક પાસેથી આરોપી હુસેન ઉર્ફે રુસ્તમ હરુનભાઈ પરમાર ધાંચી ઉ.વ-25 રહે-આટકોટ વાળો પકડાઈ જતા સી.આર.પી.સી કલમ-41.1.આઈ મુજબ અટક કરી ગરીયાધાર પો.સ્ટે ને સોંપી આપેલ છે.

3. ભારતીયા બનાવટની ચલણી જાલી નોટો બનાવનાર માસ્ટર માઇન્ડ બે ઇસમોને ત્રણ લાખની નકલી નોટો સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. ટીમ.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના અન્વયે પાટણાવાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ચલણની જાલી નોટો ના દાખલ થયેલ ગુંહાની તપાસ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા ને સોપતા તપાસ સંભાળ્યા બાદ તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સાહેબશ્રીએ બે ટીમ બનાવી જેમા ટીમ નં.-૧ માં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સાથે પો.હે.કો. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા વિજયભાઈ ચાવડા જેઓ સ્થાનિક આરોપીને પકડી પાડવા તથા ટીમ નં.-૨ જેમા વાય.બી.રાણા પો.સ.ઇ. એસ.ઓ.જી. તથા પો.હે.કો. સંજયભાઈ નિરંજની એસ.ઓ.જી. તથા બ્રિજરાજસિંહ જાડેજા એલ.સી.બી. તથા પો.કો.રહીમ દલ એલ.સી.બી. તથા પો.કો.

ધર્મેન્દ્રભાઈ ચાવડા એસ.ઓ.જી. તથા રણજીતભાઈ ધાંધલ એસ.ઓ.જી. વાળા તમામ માણસોને તાત્કાલીક અમદાવાદ ખાતે થી આ કામના મુખ્ય આરોપી ને ઝડપી પાડવા રવાના કરેલ જેઓએ મુખ્ય આરોપી હિમાંશુ તથા તેના સાગરીત અમરીશને તેના નકલી નોટના ચાલુ છાપખાના સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓ

(૧) હિમાંશુ કિર્તીભાઈ ઝવેરી જાતે વૈષ્ણવ વાણીયા ઉ.વ.૪૮ રે અમદાવાદ સી.જી.રોડ રૂપા એપાર્ટમેંટ પહેલા માળે બ્લોક નં.-૧૨

(૨)અમરીશ અરવિંદભાઈ આસોદરીયા જાતે પટેલ ઉ.વ.-૪૪ રે અમદાવાદ સી-૩૩ નરનારાયણ ઊવન ,ખોડીયાર માતાના મંદિર પાછળ નિકોલ ગામ અમદાવાદ. મુળ રે.મોટા ચારોડીયા તા.ગારીયાધાર જી.ભાવનગર

કબજે કરેલ મુદામાલ-

- રૂ. ૨૦૦૦ના દરની ભારતીય ચલણની જાલી નોટ નંગ- ૩૬ રૂ. ૭૨,૦૦૦/-જેની કિ.રૂ. ૦૦/-
- રૂ. ૫૦૦ના દરની ભારતીય ચલણની જાલી નોટ નંગ- ૪ રૂ. ૨,૦૦૦/- જેની કિ.રૂ. ૦૦/-
- મોબાઇલ ફોન નંગ-૪ કિ. રૂ. ૮,૦૦૦/-

એમ.ઓ.

આ કામના આરોપીઓએ પોતાને આર્થિક લાભ થાય તે માટે ભારતીય ચલણની જાલી નોટો હોવાની જાણકારી હોવા છતા પોતાની પાસેની જાલી નોટો બજારમા ફરતી કરી સાચી નોટો તરીકે ખરા તરીકે ઉપયોગમાં લઈ પોતાનો સમાન ઇરાદો પાર પાડી બદઇરાદા સાથે દેશના અર્થતંત્રને ગંભીરહાની પહોંચાડી આમજનતામાં, કાયદાથી સ્થાપેલ સરકાર પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર, અનાદર અને બેદીલી પેદા કરી અરાજકતા ફેલાય તે રીતે જાલીનોટો ચલણમાં મુકવા માટે આપેલ તથા જાલી નોટો કબજામાં રાખી ગુન્હો કરેલ છે.